

પત્રિકા

૧૧૨

ચિરાગે હિદાયત

૨૩/૦૬/૧૭

૨૭ રમઝાન

આ અઠવાડિયાની મુનાસેબત

૧ શબ્વાલ - ઈદુલ ફિત્ર રમઝાન ઈદ

મકસદે રમઝાન

અઝીઝો! અમુક સમયમાં જ અલ્લાહ તઆલાની અઝીમ નેઅમત ‘માહે રમઝાનુલ મુબારક’ વિદા થવાનો છે આ તે નેઅમત છે જેના દ્વારા અલ્લાહ તઆલા મોઅમીનોની રૂહાની તરબીયત કરે છે. આખા વર્ષ દરમિયાન ગુનાહોથી પરહેઝ કરવાની તાલીમ આપે છે. માહે રમઝાનના રોઝા આપણા માટે એ મૌકો છે જેમાં આપણે આપણી ઈસ્લાહ કરીએ. આપણી રૂહાનીયતને વધારીએ. આપણે જેવી રીતે રોઝાની હાલતમાં ખાવા અને પીવાથી પરહેઝ કરીએ છીએ તે આપણી માટે ગુનાહો કરવાથી, હરામ કાર્યોથી પરહેઝ કરવા માટેની તાલીમ છે. આપણને વાજિબાત પાબંદીથી અદા કરવા માટે તૈયાર કરે છે.

* **કુરઆને કરીમમાં સૂરઅે બકરહમાં અલ્લાહ તઆલા ફરમાવે છે કે**

“અચ ઈમાન લાવનારાઓ તમારા ઉપર રોઝા રાખવાનું એવી જ રીતે વાજિબ કરવામાં આવ્યું છે કે જેવી રીતે તમારા પૂર્વજો ઉપર વાજિબ કરવામાં આવ્યું હતું આ તે માટે કે તમે પરહેઝગાર બનો. (તકવા ઈખ્તેયાર કરો)”

તકવા એટલે શું ?

તકવા એટલે પરહેઝગારી. શરઈ અર્થમાં જોઈએ તો ‘તકવા’ એટલે ઈન્સાન પોતાને દરેક એવી વસ્તુઓથી બચાવે જે આખેરત માટે નુકસાનકર્તા હોય. ઈન્સાન તે કામોથી બચે જે કામ કરવાની અલ્લાહ તઆલાએ મનાઈ ફરમાવી છે.

જ્યારે હઝરત ઈમામ જાફર સાદિક^(અ.સ.)ને તકવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે આપ^(અ.સ.)એ ફરમાવ્યું “જ્યાં ખુદાનો હુકમ હોય ત્યાં તેની ઈતાઅતમાં સર તસ્લીમ કરવું અને જે કરવાની મનાઈ કરી હોય તેવા કામ કરવાથી બચે.”

- ગુનાહે કબીરા, ભાગ-૧

* તકવાના બીજા અર્થ છે :

૧) અલ્લાહ તઆલાથી ડરવું.

૨) વાજિબાતને અદા કરવી. (અલ્લાહ અને તેના રસૂલ^(સ.અ.વ.) ઉપર ઈમાન લાવવું)

૩) પોતાને ગુનાહોથી પાક કરવું, ગુનાહોથી બચવું હઝરત અલી (અ.સ.) ફરમાવે છે કે તકવા એટલે ગુનાહોને તર્ક કરવું.

તકવા શા માટે જરૂરી છે ?

ઈન્નમા ચતકબ્બલુલ્લાહો મેનલ મુતકીન.

- સૂરા નં.૫, આયત નં. ૨૭

‘ખુદા ફકત પરહેઝગારોના (આમાલ) કબૂલ કરે છે.’

- ગુનાહે કબીરા, ભાગ-૧

જો ઈન્સાન તકવાની સાથે અમલ કરશે તો ભલે પછી તે ઓછો અને નજીવો હશે પણ બારગાહે ઈલાહીમાં કબૂલ થઈ જશે.

હઝરત રસૂલેખુદા^(સ.અ.વ.) ફરમાવે છે કે “દુઆની કબૂલીયત માટે પરહેઝગાર માણસની ખૂબજ ટૂંકી દુઆ એ રીતે પૂરતી છે જે રીતે ખાવાની વસ્તુઓને સ્વાદિષ્ટ બનાવવા માટે થોડું નમક પૂરતું હોય છે.”

- ઈદતુદ દાઈ

બીજી એક હદીસમાં હઝરત રસૂલેખુદા^(સ.અ.વ.) ફરમાવે છે.

“જાણી લો કે અગર તમે એટલી નમાઝો પઢો કે તમે કમાનની જેમ જૂકી જાવ, એટલા રોઝા રાખો કે તારની જેમ પતલા થઈ જાવ તો પણ એ તમને ફાયદો નહીં પહોંચાડે અગર તમે તકવા ઈખ્તેયાર નહીં કરો અને હરામથી પરહેઝ નહીં કરો.”

- ઉદ્દતુદ દાઈ

* તકવા ઈન્સાનને હરામ કાર્યોથી બચાવે છે :

ઈમામ સાદિક^(અ.સ.) ફરમાવે છે કે :

“હરામ કોળીયો ન ખાવો તે અલ્લાહ તઆલાની નઝદીક બે હજાર મુસ્તહબ નમાઝ પડવાથી પણ વધારે ખુશીનું કારણ બને છે.

તેવી જ રીતે એક દીરહમ તેના માલિકને પાછો આપવો તે અલ્લાહ તઆલાની નઝદીક સિતરે કબૂલ થયેલી હજ સમાન છે.”

હઝરત રસૂલેખુદા (સ.અ.વ.) ફરમાવે છે “વધું પડતા લોકો બે ખુબીઓને કારણે જન્નતમાં દાખલ થશે. (૧) તકવા અને (૨) હુસ્ને ખુલ્ક.”

* હઝરત ઈમામ અલી (અ.સ.) નહુજુલ બલાગાહમાં તકવાના ફાયદાને આ રીતે બયાન કરે છે. (અમુક વાક્યો) :

જાણી લ્યો! હું તમને બધાને એ જ ખુદાથી ડરવાની ભલામણ કરું છું જેણે તમારા સર્જનનો આરંભ કર્યો અને તેના જ દરબારમાં તમારે પાછા ફરીને જવાનું છે.

આ અલ્લાહનો તકવા (તેના ખોફથી ડરી ગુનાહોથી બચવું) તમારા દિલોની બીમારીની દવા છે અને તમારા અંતરોના આંધળાપણાની દ્રષ્ટિ છે, તે તમારા દેહોની બીમારીના ઉપચારનો સામાન છે અને તમારી દિલોના ફસાદનો સુધારો છે. તે જ તમારા નફસોની ખરાબીઓને પાક કરનારો છે.

* મુતકીઓ (તકવાવાળાઓ)ની સિફતો :

હઝરત ઈમામ અલી (અ.સ.) પોતાના એક સહાબી હમામને તકવા ઈખ્તેયાર કરનારાઓના ગુણો કંઈક આ રીતે બયાન કરે છે :- (અમુક વાક્યો)

“આ દુનિયામાં મુતકી લોકો એ છે જેઓની વાતચીત સવાબ અને સત્ય હોય છે. તેમનો પહેરવેશ સાદો હોય છે. તેઓની ચાલ વિનમ્ર હોય છે. જે વસ્તુઓને પરવરદિગારે હરામ કરી છે તેનાથી નજરો નીચી રાખે છે અને પોતાના કાનોને તે વિદ્યાઓ વકફ રાખે છે જે ફાયદો પહોંચાડનારી હોય છે. તેઓના દિલ કસોટી અને પરિક્ષામાં એવા રહે છે જેવા આરામ અને શાંતિમાં રહે છે. તેઓને અઝાબનો ડર અને સવાબનો શોખ છે. અલ્લાહ તેઓની દ્રષ્ટિમાં એટલો બધો મહાન છે કે આખું જગત તેની નજરથી પડી ગયું છે.

રાત્રિઓના સમયે મુસલ્લા ઉપર ઉભા રહે છે, સુંદર કંઠે કુરઆનની

તિલાવત કરે છે, પોતાના દિલોને ગમગીન રાખે છે અને તે રીતે પોતાના દિલની બિમારીનો ઈલાજ કરે છે.

પરપરદિગારથી એકજ માંગણી કરે છે કે તેમની ગરદનોને દોઝખની આગથી આઝાદ કરી દે.

અય ખુદા! મારાથી તે વાતોની પુછપરછ ન કરજે અને મને તેઓની નેક ભાવનાથી પણ વધારે નેક બનાવી દેજે. પછી એ ગુનાહોને પણ માફ કરી દેજે જેને આ બધા નથી જાણતા.”

આમ, મૌલા અલી^(અ.સ.)એ તકવાની ભલામણ, નસીહત અને વસિયતના ઘણા બધા ખુત્બાઓ આપ્યા છે.

અઝીઝો! હજુ આપણી પાસે માહે રમઝાનના છેલ્લા દિવસો બાકી છે જે મગફેરતના છે, જેમાં ઈસ્તેઝ્કાર અને તૌબા દ્વારા ગુનાહોને માફ કરાવી લઈએ. તે પહેલા કે આ અઝીમ નેઅમતના દિવસો રૂખસત થાય. અલ્લાહની બારગાહમાં રોઈને દુઆ કરીએ કે “અય અલ્લાહ તું અમારા, અમારા વાલેદૈનના, અમારા મરહુમોના ગુનાહોને બખ્શી આપ, અમારી મગફેરત કર.”

અલ્લાહ તઆલા કુરઆનમાં ફરમાવે છે “અને અય મારી કૌમ! પોતાના પાલનહારની પાસે ઈસ્તેઝ્કાર કરો અને તેની હુજુરમાં તૌબા કરો, અલ્લાહ તમારા માટે ધોધમાર વરસાદ વરસાવશે.” (અલ કુરઆન) (વિણેલા મોતી-૪)

અઝીઝો! તૌબા અને ઈસ્તેઝ્કાર કરીને અલ્લાહ અને ઈમામને ખુશ કરીએ અને તકવા ઈખ્તેયાર કરીને નવી ઝિંદગી શરૂ કરીએ. જેથી આપણે આપણા ઈમામે ઝમાના^(અ.ત.ફ.શ.)ની કુરબત હાંસિલ કરીએ અને તેમના આવાનો અન્સારમાં અલ્લાહ આપણો શુમાર કરે.

અલ્લાહુમ્મ અજજીલ લે વલીય્હેકલ ફરજ.

પ્રકાશક : હાજીનાજી મેમોરિયલ ટ્રસ્ટ

વેબસાઈટ : www.hajinaji.com ઈમેલ : hajinajitrust@gmail.com